https://archive.org/details/bk1431/page/n0/mode/1up

2010-03-09 Reply of Satpanth propaganda in News Papers (1431)

All Items on https://archive.org/details/realpatidar

તા. ૯-૩-૨૦૧૦ના કચ્છના કચ્છમિત્ર, દિવ્ય ભાસ્કર, આજકાલ અને કચ્છ ઉદય દૈનિકમાં કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતિ તેમજ અન્ય હિન્દુ જ્ઞાતિઓને ગેરમાર્ગે દોરવા હેતુથી છપાયેલ સમાચારો વિરૂદ્ધ સચ્ચાઇ બતાવવા સજ્જડ જવાબો.

Full Library on https://realpatidar.com/library

- કચ્છ-તા. ૯-૩-૨૦૧૦.

૧. છપાણ : ૨૦૦૫નો રમેશ વાઘડીયાનો કેસ અંગત હતો, સતપંથ સમાજને કોઇ લેવા દેવા નથી.

જવાબ : અત્યાર સુધી પીરાણા સતપંથી ભાઇઓએ કરેલા તમામ કેસો (૧૯૪૦થી પહેલાં અને પછીના) વ્યક્તિગત ધોરણે જ કરવામાં આવેલ છે પણ તેની પ્રેરણા અને પાછળનું પીઠબળ સતપંથ સમાજનું જ હોય છે. તેનો મોટામાં મોટો પુરાવો તા. ૨૭-૨-૨૦૦૯ના અ. ભા. ક. ક. પા. સમાજના પ્રાંગણમાં આજ કેસની સમજુતી માટે ભેગા થયેલા ૧૫૦-૨૦૦ સતપંથી ભાઇઓ અગર તે અંગત કેસ હતો તો આટલા બધા સતપંથ સમાજના ભાઇઓ ત્યાં શા માટે ભેગા થયા હતા ? કેસ અંગત હતા તો સતપંથ સમાજ દ્વારા સમાધાન સમિતિમાં પાંચ સભ્યો શા માટે મોકલ્યા ? તાજેતરમાં બીજા ૧૭ જણા ઉપર વકીલ નોટીસ સતપંથી ભાઇઓ તરફથી આપવામાં આવી છે તે સતપંથી ભાઇઓમાંના એક માવજી ડાયા ધોળુ એ નવ સનાતની ભાઇઓ ઉપર વકીલ નોટીસ મોકલી છે તે ધી ઇમામશાહ બાવા રોજા ટ્રસ્ટના અગીયાર ટ્રસ્ટીઓમાંના એક જવાબદાર ટ્રસ્ટી છે. તે પૂરવાર કરે છે કે આ વ્યક્તિગત કેસ છે જ નહીં પણ આવા સંખ્યાબંધ કેસો સતપંથ સમાજ કોઇ એક વ્યાક્તિ મહોરૂં બનાવીને કરી રહી છે.

૨. છપાણ : ''સમાજના મુઠ્ઠીભર તત્વો પાટીદારોની એકતા તોડે છે''

જવાબ : એકતા એટલે કોની એકતા ? પાટીદાર સનાતન ભાઇઓને કે પછી પાટીદાર સતપંથી ભાઇઓની એકતા ? અ. ભા. ક. ક. પાટીદાર સમાજ (કેન્દ્રિય સમાજની) સ્થાપના કરવામાં આવી હતી તે પહેલાં આપણે સૌ મુસ્લીમ પીર ઇમામશાહ સ્થાપિત પીરાણા સતપંથ ધર્મી સતપંથ સમાજમાં જ હતા તેથી તેની ઓળખ મુમના મુસલમાન તરીકેની થઇ હતી તેને બદલવા માટે ત્યારના સુધારક વડીલોએ અર્ધદગ્ધ કબ્રસ્તાની પીરાણા સતપંથ મતનો સદંતરે ત્યાગ કરીને અ. ભા. ક. ક. પાટીદાર સમાજની સનાતની સમાજ તરીકેની સમાજની સ્થાપના કરી હતી. હવે આ સનાતની ઓળખ ધરાવતી કેન્દ્રિય સમાજમાં બાવા ઇમામ શાહના પંથ વાળા કેવી રીતે એક થઇ શકે ?

૩. છપાણ : અખિલ ભારતિય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણા (કેન્દ્રિય સમાજ) માં જુદા જુદા સંપ્રદાયના લોકો છે.

જવાબ : આ વાત ખરી છે જુદા જુદા સંપ્રદાયો એટલે વૈદિક, સનાતનહિન્દુ ધર્મ હેઠળના જુદા જુદા સંપ્રદાયો જેવા કે આર્ય સમાજી, સ્વામિનારાયણ અથવા તો લક્ષ્મીનારાયણ સંપ્રદાય. પણ સતપંથ એ સનાતન હિન્દુ ધર્મનો સંપ્રદાય નથી જ. એ એક ઇસ્લામ ધર્મનો ફાંટો છે જે અનેક જગ્યાએ ઇન્ટરનેટ પર પુરવાર થઇ ચુકેલી વાત છે. તેથી જ અ. ભા. ક. ક. પાટીદાર સમાજના સુધારક વડીલોએ પોતાની ઓળખ એક હિન્દુ તરીકે ઓળખાવવા માટે આ પીરાણા સતપંથ મતનો હમેંશને માટે ત્યાગ કરીને સનાતન હિન્દુધર્મનો અંગીકાર કરીને આજની અખીલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણાની સ્થાપના સન ૧૯૬૦માં કરી હતી. તે જ પુરવાર કરે છે કે કચ્છ કડવા પાટીદારોમાં પીરાણા સતપંથ ધર્મ પાળતા સતપંથીઓ અને શુધ્ધ સનાતન હિન્દુ ધર્મ પાળતા સનાતનીઓ જુદા છે. અને બન્નેની સમાજો પણ જુદી છે.

૪. છપાણ : મુઠ્ઠીભર તત્વો સતપંથ અને સનાતન વચ્ચે ઉભી તીરાડો કરી રહ્યા છે.....

જવાબ : ઉભી તીરાડો તો આપણા સુધારક વડીલોએ પીરાણા સતપંથ ધર્મમાં ભટકાયેલી આપણી જ્ઞાતિને સનાતન ધર્મ તરફ વાળીને સતપંથ સમાજથી અલગ થઇને જ્યારે અ. ભા. ક. ક. પાટીદાર સમાજ ઉભી કરી ત્યારે જ પાડી હતી. અત્યારે ઉભી તિરાડો બાબત પ્રશ્ન જ નથી આવતો. સતપંથ સમાજ અને સનાતન સમાજ અલગ છે તેનો મોટામાં મોટો પુરાવો તો એજ છે કે આજે આપણી હિન્દુ સનાતની ભાઇઓ તેની સમાજને (કેન્દ્રિય સમાજ) સ્થાપનાના ૫૦ વર્ષ પુરા કરી સ્વિર્ણમ મહોત્સવ ઉજવવા જઇ રહ્યા છીએ. આપણે

realpatidar.com

https://archive.org/details/bk1431/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk1431/page/n2/mode/1up

realpatidar.com

તા. ૯-૩-૨૦૧૦ના કચ્છના કચ્છમિત્ર, દિવ્ય ભાસ્કર, આજકાલ અને કચ્છ ઉદય દૈનિકમાં કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતિ તેમજ અન્ય હિન્દુ જ્ઞાતિઓને ગેરમાર્ગે દોરવા હેતુથી છપાયેલ સમાચારો વિરૂધ્ધ સચ્ચાઇ બતાવવા સજ્જડ જવાબો.

- કચ્છ-તા. ૯-૩-૨૦૧૦.

૧. છપાણ : ૨૦૦૫નો રમેશ વાઘડીયાનો કેસ અંગત હતો, સતપંથ સમાજને કોઇ લેવા દેવા નથી.

જવાબ : અત્યાર સુધી પીરાણા સતપંથી ભાઇઓએ કરેલા તમામ કેસો (૧૯૪૦થી પહેલાં અને પછીના) વ્યક્તિગત ધોરણે જ કરવામાં આવેલ છે પણ તેની પ્રેરણા અને પાછળનું પીઠબળ સતપંથ સમાજનું જ હોય છે. તેનો મોટામાં મોટો પુરાવો તા. ૨૭-૨-૨૦૦૯ના અ. ભા. ક. ક. પા. સમાજના પ્રાંગણમાં આજ કેસની સમજુતી માટે ભેગા થયેલા ૧૫૦-૨૦૦ સતપંથી ભાઇઓ અગર તે અંગત કેસ હતો તો આટલા બધા સતપંથ સમાજના ભાઇઓ ત્યાં શા માટે ભેગા થયા હતા ? કેસ અંગત હતા તો સતપંથ સમાજ દ્વારા સમાધાન સમિતિમાં પાંચ સભ્યો શા માટે મોકલ્યા ? તાજેતરમાં બીજા ૧૭ જણા ઉપર વકીલ નોટીસ સતપંથી ભાઇઓ તરફથી આપવામાં આવી છે તે સતપંથી ભાઇઓમાંના એક માવજી ડાયા ધોળુ એ નવ સનાતની ભાઇઓ ઉપર વકીલ નોટીસ મોકલી છે તે ધી ઇમામશાહ બાવા રોજા ટ્રસ્ટના અગીયાર ટ્રસ્ટીઓમાંના એક જવાબદાર ટ્રસ્ટી છે. તે પૂરવાર કરે છે કે આ વ્યક્તિગત કેસ છે જ નહીં પણ આવા સંખ્યાબંધ કેસો સતપંથ સમાજ કોઇ એક વ્યાક્તિે મહોરૂં બનાવીને કરી રહી છે.

૨. છપાણ : ''સમાજના મુઠ્ઠીભર તત્વો પાટીદારોની એકતા તોડે છે''

જવાબ : એકતા એટલે કોની એકતા ? પાટીદાર સનાતન ભાઇઓને કે પછી પાટીદાર સતપંથી ભાઇઓની એકતા ? અ. ભા. ક. ક. પાટીદાર સમાજ (કેન્દ્રિય સમાજની) સ્થાપના કરવામાં આવી હતી તે પહેલાં આપણે સૌ મુસ્લીમ પીર ઇમામશાહ સ્થાપિત પીરાણા સતપંથ ધર્મી સતપંથ સમાજમાં જ હતા તેથી તેની ઓળખ મુમના મુસલમાન તરીકેની થઇ હતી તેને બદલવા માટે ત્યારના સુધારક વડીલોએ અર્ધદગ્ધ કબ્રસ્તાની પીરાણા સતપંથ મતનો સદંતરે ત્યાગ કરીને અ. ભા. ક. ક. પાટીદાર સમાજની સનાતની સમાજ તરીકેની સમાજની સ્થાપના કરી હતી. હવે આ સનાતની ઓળખ ધરાવતી કેન્દ્રિય સમાજમાં બાવા ઇમામ શાહના પંથ વાળા કેવી રીતે એક થઇ શકે ?

૩. છપાણ : અખિલ ભારતિય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણા (કેન્દ્રિય સમાજ) માં જુદા જુદા સંપ્રદાયના લોકો છે.

જવાબ : આ વાત ખરી છે જુદા જુદા સંપ્રદાયો એટલે વૈદિક, સનાતનીહિન્દુ ધર્મ હેઠળના જુદા જુદા સંપ્રદાયો જેવા કે આર્ય સમાજી, સ્વામિનારાયણ અથવા તો લક્ષ્મીનારાયણ સંપ્રદાય. પણ સતપંથ એ સનાતન હિન્દુ ધર્મનો સંપ્રદાય નથી જ. એ એક ઇસ્લામ ધર્મનો ફાંટો છે જે અનેક જગ્યાએ ઇન્ટરનેટ પર પુરવાર થઇ ચુકેલી વાત છે. તેથી જ અ. ભા. ક. ક. પાટીદાર સમાજના સુધારક વડીલોએ પોતાની ઓળખ એક હિન્દુ તરીકે ઓળખાવવા માટે આ પીરાણા સતપંથ મતનો હમેંશને માટે ત્યાગ કરીને સનાતન હિન્દુધર્મનો અંગીકાર કરીને આજની અખીલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણાની સ્થાપના સન ૧૯૬૦માં કરી હતી. તે જ પુરવાર કરે છે કે કચ્છ કડવા પાટીદારોમાં પીરાણા સતપંથ ધર્મ પાળતા સતપંથીઓ અને શુધ્ધ સનાતન હિન્દુ ધર્મ પાળતા સનાતનીઓ જુદા છે. અને બન્નેની સમાજો પણ જુદી છે.

૪. છપાણ : મુઠ્ઠીભર તત્વો સતપંથ અને સનાતન વચ્ચે ઉભી તીરાડો કરી રહ્યા છે.....

જવાબ : ઉભી તીરાડો તો આપણા સુધારક વડીલોએ પીરાણા સતપંથ ધર્મમાં ભટકાયેલી આપણી જ્ઞાતિને સનાતન ધર્મ તરફ વાળીને સતપંથ સમાજથી અલગ થઇને જ્યારે અ. ભા. ક. ક. પાટીદાર સમાજ ઉભી કરી ત્યારે જ પાડી હતી. અત્યારે ઉભી તિરાડો બાબત પ્રશ્ન જ નથી આવતો. સતપંથ સમાજ અને સનાતન સમાજ અલગ છે તેનો મોટામાં મોટો પુરાવો તો એજ છે કે આજે આપણી હિન્દુ સનાતની ભાઇઓ તેની સમાજને (કેન્દ્રિય સમાજ) સ્થાપનાના ૫૦ વર્ષ પુરા કરી સ્વિર્ણમ મહોત્સવ ઉજવવા જઇ રહ્યા છીએ. આપણે

realpatidar.com

realpatidar.com

ઉજવણી કરવા જઇ રહ્યા હોત. માટે એ પણ પુરવાર થાય છે કે આ સ્વર્ણિમ મહોત્સવ સનાતની ભાઇઓનો મહોત્સવ છે ન કે સતપંથી ભાઇઓનો મહોત્સવ. કારણ કે આ સતપંથી ભાઇઓની સતપંથ સમાજ તો ૫૦૦ વર્ષ જુની સમાજ છે.

૫. છપાણ : અખિલ ભારતિય કચ્છ કડવા પાટીદાર સમાજના બંધારણને દરેક પાટીદારો માનતા આવ્યા છે....

જવાબ : આ વાત તદ્દન જુઠી વાત છે આવું જો હોત તો સતપંથી ભાઇઓ મુસ્લીમ આચરણ વાળા મુસ્લીમ પીર બાવા ઇમામ શાહ સ્થાપીત ધર્મનો સદંતરે ત્યાગ શા માટે નથી કરતા. કોઇ પણ સમાજ હોય તે એકજ ધર્મવાળો સમાજ હોઇ શકે ? આ સતપંથીઓને પુછો કે કોઇ પણ સનાતની ભાઇ આ સતપંથ સમાજમાં છે તો પછી સનાતનની હિન્દુ ધર્મની ઓળખ ધરાવતી અ. ભા. ક. ક. પાટીદાર સમાજમાં વિધર્મી (સતપંથ ધર્મી) ભાઇઓ કેમ હોઇ શકે ? www.gujaratilexicon.com. માં 'સમાજ' શબ્દની વ્યાખ્યા સ્પષ્ટપણે આલેખાયેલ છે તે મુજબ સમાજ એને જ કહેવાય જે વ્યવસ્થિત લોકોનો જનસમુદાય

૧). એકજ રીતી રીવાજ પાળતો હોય

૨). એકજ ધર્મ (સનાતન હિન્દુ ધર્મ) પાળતો હોયલ

૩). એક જ આચાર-વિચારને વરલો હોય,

તે પ્રમાણે અ. ભા. ક. ક. પાટીદાર સમાજ હિન્દુ સનાતન સમાજ હોવાથી અન્ય ધર્મીઓ જેવા કે સતપંથ ધર્મીઓ જ્યાં સુધી તેનો સદંતરે ત્યાગ કરી સનાતન હિન્દુ ધર્મનો અંગીકાર ન કરે ત્યાં સુધી આ સમાજનો સભ્ય બનીજ કેમ શકે ?

૬. છપાણ : સતપંથ સમાજ સ્વર્ગીય સતપંથાચાર્ય કરશનદાસજી મહારાજે સતપંથ સનાતન સમાજનો વિકાસ કરીને ક્રાંતિ સર્જી હતી.

જવાબ : આ વિધાન તદ્દન જુઠું છે. કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ પીર ઇમામ શાહની તરકીબોમાં આવીને સતપંથ ધર્મનો અંગીકાર કર્યો હતો. જેવી રીતે આ સતપંથ ધર્મનો લોહાણાએ અંગીકાર કરી ખોજા બન્યા તેવી રીતે કચ્છી કડવા પટેલોએ આ સતપંથ ધર્મનો અંગીકાર કરીને મુમના-મુસલમાન તરીકેની ઓળખ કાયમ કરી હતી. તે ઓળખ મીટાવવા માટે લગભગ ૨૦૦ વર્ષ પહેલાં તત્કાલીન જ્ઞાતિના આદ્ય સુધારકો વડીલ શ્રી કેસરા પરમેશ્વરા તેમજ વડીલ શ્રી નારાણજી રામજી લીંબાણી અને તેમના સહોયોગીઓના અથાગ પરીશ્રમની ફળશ્રુતિએ આખી જ્ઞાતિને પીરાણા સતપંથમાંથી છોડાવી સનાતન હિન્દુ ધર્મ તરફ વાળ્યા. પણ અમુક સતપંથી ભાઇઓના જીદ્દી અને ધર્માંધતા જેવા વલણને લઇને પીરાણા સતપંથને વળગી રહ્યા તેને પ્રોત્સાહન આપીને આ કહેવાતા સતપંથાચાર્યોએ ફરી પાછા જ્ઞાતિની સાથે છેતરપીંડી કરીને સનાતન ધર્મ તરફ વળેલી જ્ઞાતિને સતપંથ ધર્મ તરફ વાળવાની બેહુદી હરકત કરી સમાજને વિચ્છેદ કરવાના હીન કક્ષાના પગલાં ભર્યા તેનું શ્રી અ. ભા. ક. ક. પાટીદાર સમાજના સનાતની ભાઇઓને પારાવાર દુઃખ છે. આ જ્ઞાતિને ૧૫૯૨માં મુસ્લીમ પીર ઇમામશાહે છેતરી ત્યાર પછી મોટામાં મોટી છેતરપીંડી આ જ્ઞાતિની કરી હોય તો તે કહેવાતા સતપંથાચાર્ય સ્વર્ગીય કરશન કાકાએ જેનું સતપંથ નામ ઇન્ટરનેટ ઉપર અને માન્યતાપ્રાપ્ત પુસ્તકોમાં પીર કરીમ તરીકે વર્ણવામાં આવ્યું છે. આજ કરશન કાકાએ તો સસ્તી પ્રચાર શૈલી અપનાવી ઉપરછલ્લા સર્ટીફીકેટો ઉભાં કર્યા. કહેવાતી હલકી પ્રકારની પ્રક્રિયા કરી સતપંથ સમાજને હિન્દુ બતાવવા કાલાવાલા કરી પૈસાના જોરે ફક્ત કડવા પાટીદાર સમાજને નહીં પણ આખા દેશને ગેરમાર્ગે દોરે છે. જ્ઞાતિને પણ સુધારાની પ્રક્રિયાઓ બતાવી ગેરમાર્ગે દોરે છે. સાધુ સમાજને પણ ગુમરાહ કરેલ છે. પૈસા ખર્ચીને પી.એચ.ડી. કરી ડોકટરી સર્ટીફીકેટ મળેજ છે તો આવા સર્ટીફીકેટની કિંમત ખરી ?

૭. છપાણ : ધાર્મિક પુસ્તકો કે લેખોમાં કરશનકાકાના સમયમાં ફેરફારો કરવામાં આવ્યા.

જવાબ : હા! આ વાતને અમો પણ સ્વીકાર કરીએ છીએ. સવંત ૧૫૯૨ના અરસામાં આ જ્ઞાતિને વટલાવવા માટે હિન્દુ શાસ્ત્રોને આ મુસ્લીમ પીર ઇમામશાહે ઇસ્લામીકરણ કર્યું ત્યાર પછી આ પંથને હિન્દુ પંથ તરીકે બતાડવા અનેક સમયે પ્રયત્નો થયા અને છેલ્લે પીરજાદા ખાકી નામના એક સૈયદની સલાહથી જે સાહિત્યો પીર ઇમામશાહે પ્રગટ કર્યા હતા તેને ફરી પાછા વટલાવવા માટે પીરાણાના કરશન કાકાએ પ્રયત્નો કર્યા તેનો હેતુ માત્ર એ જ હતો એ આ જ્ઞાતિ જે સંપુર્ણપણે સનાતન હિન્દુ ધર્મ પાળવા લાગી ગઇ હતી તેને સતપંથ તરફ વાળવાના પ્રયાસો કર્યા અને આખી જ્ઞાતિને ફરી ગેરમાર્ગે દોરી તે વાતનું પારાવાર દુઃખ છે.

૮. છપાણ : અખીલ ભારતિય કચ્છ કડવા પાટીદાર સમાજનો ૫૦ વર્ષનો સ્વર્ણિમ મહોત્સવ સનાતન અને સતપંથ ધર્મીઓનો મહોત્સવ છે.

realpatidar.com

realpatidar.com

અને પીરાણા સતપંથ મતનો કાયમને માટે ત્યાગ કરી સનાતન હિન્દુ ધર્મ નો અંગીકાર કરી સનાતન ભાઇ ઓના હિતોની રક્ષા કરવા માટે જ કરવામાં આવી હતી. આ વડીલોને ચોકકસપણે લાગ્યુ હતુ કે સંતપથ ધર્મ ને લઇને આપણી ઓળખ અન્ય સમકક્ષ જ્ઞાતિઓમાં એક મુસલમાન મુમના તરીકે હતી એટ્લે આ સતપંથ ધર્મનો અને સતપંથ સમાજનો ત્યાગ કર્યો હતો. આ ૫૦ વર્ષ દરમ્યાન આ સતપંથી ભાઇઓએ સનાતની હિન્દુ ઓળખ ધરાવતી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણાની આડસમાં પોતાને હિન્દુ તરીકે ઓળખાવવાની સીધી અને આડકતરી રીતે મદદ લીધી છે તેમા શંકાને લેશ માત્ર સ્થાન નથી.

૯. છપાણ : ગંગેશ્વરજી મહારાજે કહ્યું હતું કે સતપંથ સંપ્રદાય હિન્દુ સંસ્કૃતિની મોટી તાકાત છે....

જવાબ : જે લોકેને હિન્દુ સંસ્કૃતિ સાથે સ્નાન સુતકનો સંબંધ નથી એવા લોકોને એમ હોય કે સતપંથ સંપ્રદાય હિન્દુ સંસ્કૃતિની મોટી તાકાત છે તે વાત કેટલી હાસ્યાસ્પદ છે. ઇન્ટરનેટ ઉપર wikipidiaમાં જઇને ''સતપંથ'' શબ્દની વ્યાખ્યા તો જુઓ તે શું છે. તેની તમામ માહિતીઓ મોજુદ થઇ અરે તેમના ધર્મગુરૂ ઇરાનથી એક માત્ર મકસદ લઇ ને કે હિન્દુઓને મુસલમાન તરફ વટલાવી જનાર સૈયદ પીર ઇમામશાહે તો ન કેવળ કડવા પટેલ જ્ઞાતિને ભ્રષ્ટ કરી પણ સાથે સાથે હિન્દુ શાસ્ત્રો ને પણ ભ્રષ્ટ કર્યાં તેના અસંખ્ય પુરાવાઓ મોજુદ છે. મુસ્લીમ પીર બાવા ઇમામશાહ દ્વારા નિર્મિત સતપંથ સંપ્રદાય હિન્દુ સંસ્કૃતિ ની મોટી તાકાત છે. તેમ કહેવું સમગ્ર હિન્દુ સમાજ ની આંખમાં ધુળ નાખવા બરાબર છે. ઇન્ટરનેટમાં "wikipedia, the freecncyclopedia" માં સતપંથ એટલે શું તની માહિતી અંગ્રેજીમાં નિચે મુજબની આપવામાં આવી છે. "Satpanth is a Subgroup of Nizari Ismaili Sufism formed by Conversions from Hinduism 700 years ago by PIR Sadruddin (1290-1367) and 600 years ago in the 15th Century by his grandson PIR Imamshsh (1430-1520), one of the authors of the Ginans. There are villages in Gujarat which are totally "Satpanthi" such as Pirana near Ahamedabad where Imamshah is burried."

૧૦.છપાણ : રમેશભાઇ વાઘડીયા પર ૨૦૦૫માં થયેલી ધાર્મિક ફરીયાદને લઇને મોટો ઉહાપોહ કરવામાં આવી રહ્યો છે.

જવાબ : આ તદ્દન વાહિયાત વાત છે. જે માણસે રમેશભાઇ માવજીભાઇ વાઘડીયા તથા તેના પિતા માવજીભાઇ રતનશી વાઘડીયા અને તેના દાદા રતનશી નારણ વાઘડીયા ઉ. વ. ૯૮ ઉપર કરેલી ખોટી પોલીસ ફરીયાદોઅવંતદ્દન જુઠા કોર્ટ કેસો કરેલા છે તેને રમેશભાઇ તેમજ તેના પરિવારે જોયો પણ નથી કહેવાય છે કે આ માણસ નામે મણીલાલ કાનજી છાભૈયા પીરાણા ગાદીપતી કરશનદાસ કાકાનો ભત્રીજો છે અને આવી સંસ્થા તેની પાછળ છે કારણ કે જ્યારે શુક્રવાર તા. ૬-૩-૨૦૧૦ના રમેશભાઇ વાઘડીયાને મીરજાપુર અમદાવાદ કોર્ટમાં જામીન માટે જજ સમક્ષ રજુ કરવામાં આવ્યા ત્યારે ત્યાં હાજર પીરાણા સતપંથ ભાઇઓએ જામીન ન મળે તે માટે તમામ નિરર્થક પ્રયાસો કર્યા હતા. તેથી તે પુરવાર થાય છે કે આવા કેસોની પાછળ આખી સતપંથ સમાજનું પીઠબળ છે. ભુતકાળમાં પણ આવા અસંખ્ય કેસો આમ વ્યક્તિગત દેખાતા હોય પણ તે પાછળ આખા પીરાણા સતપંથ સમાજનું પીઠબળ હોય છે. તેમાંના અમુક કેસો નિચે ટાંકિલા છે તે શું વ્યક્તિગત કેસો હતા ?

૧) અ. ભા. ક. ક. પાટીદાર સમાજના પ્રમુખ ઉપર કરવામાં આવેલ કેસ.

૨) અ. ભા. ક. ક. પાટીદાર સમાજના ટ્રસટીઓ ઉપર કરવામાં આવેલ કેસ.

૩) કોટડા સમાજના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપર કરવામાં આવેલ કેસો.

૪) અત્યારે મોડાસા ખાતે લગભગ ૩૦ જણા ઉપર કરવામાં આવેલી પોલીસ ફરીયાદો અવં ખોટા કોર્ટ કેસો.

૫) કાદિયા નાના ગામમાં સતપંથીઓ દ્વારા કરવામાં આવેલા તદ્દન ખોટા મિલ્કતોને લગતા કોર્ટ કેસો વિગેરે વિગેરે.

અત્યારે જે સતપંથ સમાજ અને ધર્મનું પાખંડીતતાનું અને છેતરપીંડી બાબતનું ઉઘાડા પાડવાની બાબતનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે એક આઠ જણા ઉપર અને બીજા નવ જણા ઉપર વકીલ મારફત નોટીસો અપાઇ છે તે શું વ્યક્તિગત ધોરણે છે ? ના, તેની પાછળ આખો સતપંથ સમાજ કામે લાગી ગયો છે. પણ તેની સામે સનાતની હિન્દુ ભાઇઓ તરફથી સતપંથીઓ ઉપર એક પણ કેસ થયો નથી તેનો ઇતિહાસ સાક્ષી છે. સત્ય જ્યારે બહાર આવે છે ત્યારે જુઠ્ઠા લોકો તેને સાંખી શકતા નથી. ટુંકમાં...

realpatidar.com

realpatidar.com

૨) હમણા કોટડા (જ.) માં એક સતપંથી વડીલનું અવસાન થતાં મુસ્લીમ કબ્રસ્તાનની બાજુમાં તેના શબની દફનવિધિ કરેલ તે જગ જાહેર છે. આ શું હિન્દુના બાહ્ય આચરણો છે ?

૩) તા. ૮-૩-૨૦૧૦ ના નિષ્કલંકી ધામમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં સતપંથ સમાજના મુખ્ય વ્યક્તિ તરીકે હાજર ખોંભડીના મગન પરબત ભગતે તાજેતરમાં જ તેમના પિતાનું નવસારી મુકામે નિધન થતાં તેમના શબને ખોંભડી લઇ જઇ દફનાવ્યું. તે શું તેના બાહ્ય આચરણો હિન્દુના કરી રહ્યા છે ? તે તો શુધ્ધ મુસ્લીમ આચરણો જ કહેવાય.

૪) અંગીઆ ગામના જ એક સતપંથી ભાઇ જેઠા શીવજી રૂડાણી જે પીરાણાના ધી ઇમામ શાહ બાવા રોજા ટ્રસ્ટના અગિયાર ટ્રસ્ટી માંચના કડવા પટેલ તરીકેના એક ટ્રસ્ટી છે. તે સતપંથીએ તાજેતરમાં જ અંગીઆમાં તેની પત્નિનું અવસાન થયું ત્યારે તેના શબને ઘરની બાજુમાં જ દફનાવ્યું છે. તે શું તેના બાહ્ય આચરણો હિન્દુના થયા ? તેવા માણસો શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના (હિન્દુ સમાજના) સભ્ય કેવી રીતે બની શકે ?

૫) આ સતપંથીઓને અ. ભા. ક. ક. પાટીદાર કે જે હિન્દુ સનાતન ધર્મની ઓળખ ધરાવે છે તેની આડસ જોઇએ છે. આડસ એટલા માટે કે તેઓ પોતે પીરાણા સતપંથ ધર્મમાં રહી અમુક મુસ્લીમ આચરણ કરતા હોવા છતાં હિન્દુ તરીકેની છાપ ઉભી કરવી છે તે શક્ય તો જ બને કે તેઓ આ સનાતની કેન્દ્રિય સમાજની આડસમાં જીવે તો જ ? આ સતપંથીઓને ચેલેન્જ આપી શકાય કે પાંચ થી દશ વર્ષ આપણી અ. ભા. ક. ક. પાટીદાર સમાજની વગર આડસે અલગ થઇને પોતાની જાતને હિન્દુ તરીકે જીવી બતાવે અને અન્ય સક્ષમ જ્ઞાતિઓમાં તેઓ એક મુસલમાન તરીકે ઓળખાણ ન થાય તો આ કડવા પાટીદાર જ્ઞાતિ સર્વે સતપંથ ધર્મ સ્વીકારવા તૈયાર થઇ જશે પણ સામે સ્થાને તેઓ પણ એ વાત સ્વીકારે કે અગર તેઓની ઓળખ અન્ય હિન્દુ સમાજમાં એક મુમના મુસલમાન તરીક થાય તો તેઓ આ સમાજને આડા ન આવે.

૧૧. છપાણ : અખિલ ભારતિય કચ્છ કડવા પાટીદાર સમાજના બંધારણને દરેક પાટીદારો માનતા આવ્યા છે...

જવાબ : આ વાતમાં કોઇ વજુદ નથી. સમાજના સતપંથી ભાઇઓ અ. ભા. ક. ક. પાટીદાર સમાજના બંધારણ તેમજ રીત રીવાજોની કલમ નં. ''૧૮ અને ૧૯નું સદતંરે ઉલંઘન કરતા રહેલા છે. ''કલમ ૧૮ અન્વયે સમાજના દરેક સભ્યોએ તેમનું બાહ્ય આચરણ જન્મથી મરણોતર સુધીનું હિન્દુનું હોવું જોઇએ'' તો આ સતપંથ સમાજના ભાઇઓને પુછો કે શું તેઓ આ કલમનું ચુસ્તપણે પાલન કરે છે ? તેઓ આ કલમનું ખુલ્લેઆમ ભંગ કરે છે.
કલમ ૧૯ અન્વયે જે સભ્યને ધાર્મિક અથવા તો સામાજીક મનદુ:ખ હોય તો તે સામાજીક ન્યાય મેળવવા માટે ઉપલબ્ધ ન્યાય સમિતિ પાસે ન્યાય મેળવી શકે છે કોર્ટનો આશરો લેવાની મનાઇ હોવા છતાં સતપંથ સમાજના ભાઇઓ સદંતરે ખુલ્લેઆમ આ કલમ ૧૯નો ભંગ કરી રહ્યા છે.

ઉપરોક્ત કારણોને લઇને એ વાત પુરવાર થાય છે કે આ સનાતન હિન્દુ ઓળખ ધરાવતી આ સમાજ (અ. ભા. ક. ક. પાટીદા સમાજ) માં રહીને સતપંથી ભાઇઓ સતપંથ ધર્મ પાળતા હશે તો તે કોઇ દિવસ ચલાવી લેવામાં નહીં આવે અને તે શક્ય પણ નથી.

અસ્તુ.

realpatidar.com